https://archive.org/details/bk753/page/n0/mode/1up

2010 Before -Tulsidas Krut Agamvani (Fake) (753)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

आगम वाणी
तुलसीदासकृत आगमवाणी

टीकाकार प्रणामी धर्माचार्य श्री कृष्ण प्रियाचार्यजी महाराज सुरत

भव तारण भगवंत भज, धारण उर धर ध्यान ॥
यो धारण आगम एही, निहकलंक जेहि नाम ॥ १ ॥

ભગત તુલસીદાસ ભણે છે કે હે મનુષ્ય જન્મમરણથી છોડાવનાર ભગવંતને તું ભજ અને ઉરમાં ધ્યાન ધારણ કર, તે ધારણ શ્રી નિષ્કલંક ભગવાનનું આગમનરૂપ છે ૧

चौद तुरका दश हि भूरका जुल्म करका हजार बरका,
कसत कधरको गज्य हि करका मुन करंदा दुःख आता।
किल किल हुंदा भूतानंदा बगरंदा मदमार्ता
मैं गुरू गुरू गाता ऊर उमराता आगम आता दरशाता ॥१॥

શ્રી ભાગવતના ૧૨ સ્કંધ ૧ અધ્યાયમાં ભવિષ્યના રાજાઓની ગણત્રી બતાવી છે તેમાં ૮ યવન પછી થનારા ૧૪ તુરકોથી ગણે છે કે-૧૪ તુર્ક, ૧૦ ભુરા કેશવાળા એવા ગુરૂડ નૃપતિ થશે તેઓ ૧૦૦૮ વર્ષ સુધી રાજ્ય કરી પ્રજા પીડશે, ઘણાને કેદ કરશે પછી મૌન રાજા થશે તેઓ ૩૦૦ વર્ષ રાજ્ય કરી પ્રજા પીડશે પછી કિલકિલા નગરીમાં ભુતાનંદ રાજા થશે, તે દુષ્ટ પછી બંગીરીનામ દુષ્ટ મદમાતો નૃપ થશે, જે સર્વ અસહ્ય દુઃખ દેશે તેથી હું મારા ગુરૂજીને યાદ કરી ગુણ ગાઉ છુ. મારૂ હૈયુ ભરાઇ જાય છે, કારણ કે ભયંકર આગમ આવતું જણાય છે....૧

ताका अनुजंदा हो शिशुनंदा ताका नंदा बरजंदा,
प्रचरीक हुदा शक बरतंदा राज्य करदा रजंदा।
गत एक खटंदा बरस बितदा वाल्हि* थिंदा बतलाता,
मैं गुरु गुरु गाता उर उमदाता आगम आता दरशाता ॥२॥

તે બંગીરીનો ભાઈ શિશુનંદિ થશે, તેનો યજ્ઞોનંદ થશે તે પણ ધર્મથી લોકોને રોકશે. પછી પ્રવીરક પોતાનુ શક ચલાવી ૧૦૬ એકસો છ વર્ષ લગી પ્રજાને રંજાડતો રાજ્ય કરશે આ રીતે એકસો છ વર્ષ કે જે વિ. સં ૧૧૦૯ ગણાય તે વિતાવશે, પછી વાલ્હિક થશે એવું હું તમોને બતાવુ છું ને ગુરૂ ગુરૂ એવું ગાઉ છું....૨

जग जुल्म न मिन्सा पाप न चिन्सा क्षत्रियजनका विष विनशा
जग जुल्म पतइन्सा भूपत थिन्सा रजनी दिनसा कह हिंसा।
तो वरणन किन्सा धरम नचिन्सा धर्म न गिन्सा पत्राता
मैं गुरू गुरू गाता उर उमराता आगम आता दरशाता ॥३॥

જે રાજાઓ પોતાના અત્યાચારને જગતના જુલમ તરીકે નહી માને, પાપને નહી ઓળખે, તે સમયે ક્ષત્રિયોનું ભવિષ્ય બગડેલું હશે બધા લોકો વેદ ધર્મ મુકી અધર્મ ઉપર ખુબ પની જશે તેથીજ પાપી રાજાઓ રાત દિન. દિનને રાત કહી દેશે તોય લોકો માની બેસશે. તેથી જ કહ્યું છે કે લોકો ધર્મ નહી ઓળખે વૈદિક કર્મ કાંડ કે જે દુનીયાને પાપ કરતાં અટકાવનારને અંતઃકરણને શુદ્ધ કરનારને યથેચ્છાચારને સકેચનાર છે તેને શ્રેષ્ટ તરીકે નગણી કુકર્મ કરવા લાગશે. એવું અત્યારથીજ જણાય છે તેથી હું દુઃખી થઈ ગુરૂ ગુરૂ ગાઉ છું....૩

realpatidar.com

https://archive.org/details/bk753/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 3, 4.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk753/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.19 15:20:47 +05'30'

Real Patidar
Unravel Truth

realpatidar.com

आगम वाणी

तुलसीदासकृत आगमवाणी

ટીકાકાર પ્રણામી ધર્માચાર્ય શ્રી કૃષ્ણ પ્રિયાચાર્યજી મહારાજ સુરત

भव तारण भगवंत भज, धारण उर धर ध्यान ॥
यो धारण आगम एही, निहक्कलंक जेहि नाम ॥ १ ॥

ભગત તુલસીદાસ ભણે છે કે હે મનુષ્ય જન્મમરણથી છોડાવનાર ભગવંતને તું ભજ અને ઉરમાં ધ્યાન ધારણ કર, તે ધારણ શ્રી નિષ્કલંક ભગવાનનું આગમનરૂપ છે ૧

चौद तुरका दश हि भूरका जुल्म करका हजार बरका,
कसत कधरको गज्य हि करका मुन करंदा दुःख आता।
किल किल हुंदा भूतानंदा बगरंदा मदभार्ता
मैं गुरू गुरू गाता ऊर उमराता आगम आता दरशाता ॥१॥

શ્રી ભાગવતના ૧૨ સ્કંધ ૧ અધ્યાયમાં ભવિષ્યના રાજાઓની ગણત્રી બતાવી છે તેમાં ૮ યવન પછી થનારા ૧૪ તુરકોથી ગણે છે કે-૧૪ તુર્ક, ૧૦ ભુરા કેશવાળા એવા ગુરૂડ નૃપતિ થશે તેઓ ૧૦૦૮ વર્ષ સુધી રાજ્ય કરી પ્રજા પીડશે, ઘણાને કેદ કરશે પછી મૌન રાજા થશે તેઓ ૩૦૦ વર્ષ રાજ્ય કરી પ્રજા પીડશે પછી કિલકિલા નગરીમાં ભુતાનંદ રાજા થશે, તે દુષ્ટ પછી બંગીરીનામ દુષ્ટ મદમાતો નૃપ થશે, જે સર્વ અસહ્ય દુઃખ દેશે તેથી હું મારા ગુરૂજીને યાદ કરી ગુણ ગાઉ છુ. મારૂ હૈયુ ભરાઈ જાય છે, કારણ કે ભયંકર આગમ આવતું જણાય છે....૧

ताका अनुजंदा हो शिशुनंदा ताका नंदा बरजंदा,
प्रचरीक हुदा शक बरतंदा राज्य करदा रजंदा।
गत एक खटंदा बरस बितदा वाल्हि* थिंदा बतलाता,
मैं गुरु गुरु गाता उर उमदाता आगम आता दरशाता ॥२॥

તે બંગીરીનો ભાઈ શિશુનંદિ થશે, તેનો યજ્ઞોનદ થશે તે પણ ધર્મથી લોકોને રોકશે. પછી પ્રવીરક પોતાનુ શક ચલાવી ૧૦૬ એકસો છ વર્ષ લગી પ્રજાને રંજાડતો રાજ્ય કરશે આ રીતે એકસો છ વર્ષ કે જે વિ. સં ૧૧૦૯ ગણાય તે વિતાવશે, પછી વાલ્હિક થશે એવું હું તમોને બતાવુ છું ને ગુરૂ ગુરૂ એવું ગાઉ છું....૨

जग जुलम न मिन्सा पाप न चिन्सा क्षत्रियजनका विघ विनशा
जग जुलम पतइन्सा भूपत थिन्सा रजनी दिनसा कह हिंसा।
तो बरणन किन्सा धरम नचिन्सा धर्म न गिन्सा पत्राता
मैं गुरू गुरू गाता उर उमराता आगम आता दरशाता ॥३॥

જે રાજાઓ પોતાના અત્યાચારને જગતના જુલમ તરીકે નહી માને, પાપને નહી ઓળખે, તે સમયે ક્ષત્રિયોનું ભવિષ્ય બગડેલું હશે બધા લોકો વેદ ધર્મ મુકી અધર્મ ઉપર ખુબ પતી જશે તેથી જ પાપી રાજાઓ રાત દેન. દિનને રાત કહી દેશે તોય લોકો માની બેસશે. તેથી જ કહ્યું છે કે લોકો ધર્મ નહી ઓળખે વૈદિક કર્મ કાંડ કે જે દુનીયાને પાપ કરતાં અટકાવનારને અંતઃકરણને શુદ્ધ કરનારને યથેચ્છાચારને સકેચનાર છે તેને શ્રેષ્ટ તરીકે નગણી કુકર્મ કરવા લાગશે. એવું અત્યારથી જ જણાય છે તેથી હું દુઃખી થઈ ગુરૂ ગુરૂ ગાઉ છું....૩

realpatidar.com

https://archive.org/details/bk753/page/n3/mode/1up

realpatidar.com

सब पापी परजा तामस तरजा तुच्छ उमरजा एह खाजा.
लोभी नरजा मन मत गरजा घर घरना शिरताजा ।
पूत मात मनूनी बात तनूनी अनुजा अनुजहि नहि नाता
मैं गुरु गुरु गाता उर उभराता आगम आता दरशाता ॥४॥

વળી પ્રજા પાપી અને મહાતામસી થઇ અલ્પાયુષી બની જશે ? તે લોભી નરોના મન બુદ્ધિ તથા ઘર ઉપર સ્ત્રીઓ સરદારી કરશે પુત્ર માતા માનિની પિતા વહુ ભાઈ બહેન એ બંધનો સબંધ તુટી જોરું ખસમનો નાતો થઈ જશે આમ થવાથી લોકોમાં ભગસેવા પ્રચલિત થઈ પડશે....૪

परत अकाला बहुत कराला जग बेहाला हर साला,
पापी कुप ताला नदि नद नाला जल विन टाला ए हाला ।
रतनाकर जाता विरहां थाता वारि विकाता लखाता,
मैं गुरु गुरू गाता उर उभराता आगम आता दरशाता ॥५॥

આમ વિષયભોગ પરસ્ત્રાને લીધે વારંવાર કરાલ દુષ્કાળ પડશે. તેથી વર્ષો વર્ષ જગત બેહાલ દુર્દશાગ્રસ્ત થશે વાવ કુવા તળાવ નદી મોટી નદી નાળા એ બધા જલાશયો જળ વિનાના ઠાલા થઇ જશે, સમુદ્ર પણ સુકાઈ જશે ને લોકો જલાર્થે સાગરમાં ખાડા ખોદી પાણી કાઢશે તે સમયે પાણી વેચાશે ને તેના પણ દુકાનો હશે એવું જણાય છે તેથી હું તો ગુરૂનું સ્મરણ કરું છું...૫

नागरवेला फुल फुलेला ऊखा घोना जामेला,
नाग करेला निरावष हेला थोरे केला घनु जस होला ।
कगवा धोला कोयल बहुधा हंसा बगला बन जाता.
मै गुरू गुरु गाता उर उभराता आगम आता दरशाता ॥६॥

તે સમયે નાગરવેલમાં ફુલ ફલ પણ આવશે શેરડીમાં બીજ થશે અથવા શેરડીથી ડાંગ (ધાન્ય) પેદા થશે વા શેરડી બીજ ઉગશે નાગફળી વેલથી કારેલા પાકશે હેલા નિર્વિષ થશે. થોરના ઝાડમાં કેળા પાકશે ગાયો હોલા જેવી થઈ જશે. કાગડો ધોળો થઇ જશે. બગલા અને હંસ કોયલ સમાન કાળા બની જશે, તેથી હું તો ગુરૂ ...૬

बीज संत बहूता कसी सहूप्ता भगत सपूता दुःख होता,
धेनुधर रोता धीर धरुता अरज करूता सब सूता ।
प्रभु जब सुना पुकारा धरि अवतरा अखंड विलारा जाता
मै गुरू गुरु गाता उर उभराता आगम आता दरशाता ॥७॥

સંતબીજ જે મહાત્મા સાધુ વેરાગી ત્યાગી સન્યાસી છે તેના ઉપર ઘણીજ ખીચાખીચ નાખી બધાને કસી કરી બાંધી નાખી કેદ કરશે જે કોઇ સપૂતા (સુપાત્ર) ભગત હશે તેને ઘણુ દુઃખ પડશે, ગાયોને રાખનાર ગાયપાળક દુઃખી થઈ રડારડ કરશે, સર્વ રુદન કરી હરીને અરજ કરશે, જ્યારે પ્રભુએ પોકાર સુણી ત્યારે અવતાર ધર્યો ને અખંડ સનાતન મત ઉપર ચાલી દરેકને તે પંથેજ લઈ જાય છે...૭

गंगातट गामा अति हि ललमा संभल नाग सो गामा
विष्णु जसवामा मतंगी धामा पूरनकामा घनश्यामा ।
रवि शशी गुरु करही मकर ठरहो तब अवतरही जगत्राता,
मैं गुरु गुरु गाता उर उभराता आगम आता दरशाता ॥८॥

realpatidar.com

https://archive.org/details/bk753/page/n4/mode/1up

realpatidar.com

ગંગા કાંઠે અતિ સુંદર સંભલ નામ નગર છે ત્યાં વિષ્ણુયશાની અથવા ધનકરિખની પત્ની માતંગી બાઈના ઉદરમાંથી ધનશ્યામ પ્રભુ જે છે તે સુર્ય ચંદ્ર ગુરૂ મકર કર્ક રાશિમા આવશે તે શુભ ગ્રહ વેળાયે અવતરશે....૮

पितु मातु सयाना स्वर्ग पठाना आप घर पठानका बाना,
साहिक जग जाना पीर कहाना ज्ञान निधाना गुनखाना ।
तन घनश्यामवरना भुज आजाना चंद्रसमाना मुज माता,
मैं गुरु गुरु गाता उर उभराता आगम आता दरशाता ॥९॥

કલ્કીના શાણા માત પિતા સ્વર્ગવાસી થયા ત્યારે આપ પઠાણનો વેષ પહેરી લીધા તેમને આજે જગત પીરશાહ એ નામે ઓળખે છે તેઓ જ્ઞાનસાગર ગુણ ભંડાર છે. તનુ ધનશ્યા છે અથવા પોતે ભગવાન છે, ઢીંચણ સુધી લાંબા હાથ છે, ચંદ્રસમાન મુખ છે...૯

शिरताज सुधारा वमन लिंगारा खडग उघाडा मीधारा,
देवांगी स्वारी दुष्ट संहारा करत ऊधारा संसारा ।
नर कबर समाता ताहि जगाता लेत संगाता हरखाती,
मैं गुरु गुरू गाता ऊर ऊभराता आगम आता दरशाता ॥१०॥

શિર પર તાજ ધારેલું છે, વસ્ત્રથી શણગારેલા છે, ઉઘાડી તલવાર હાથમાં છે, દેવદત વા જીવરઈલનામ ઘોડા ઉપર અવતાર છે, દુષ્ટને વહારે છે સંસારનો ઉદ્ધાર કરે છે, જે નરનારી કબરમાં દાટેલા કે શમાયા છે, તેઓને જીવાદી સાથે લઈ હરખાતા વિચરે છે....૧૦

दिल्ली जब आवत अमल फिरावत दुष्ट हरावत दर बाबत,
सब भूप बोलावत धर्म सिखावत धर्मकावत भडमाया ।
तह वांह भरावत शपथ करावत नियम करावत शुभ थाता,
मैं गुरू गुरु गाता ऊर ऊभराता आगम आता दरशाता ॥११॥

જ્યારે દિલ્લીમાં આવે છે અને ત્યાં પોતાનો અમલ ચલાવે છે ત્યારે દરેક બાબતમાં દુષ્ટોને હરાવે છે ત્યાં બધા તપોને બોલાવી ધર્મ શીખવાડે છે. મોટા મોટા ભાટ વીરોને ધમકાવે છે, બધાને ભેટાવે છે શપથ લેવરાવે છે તેનાથી શુભ થાય છે....૧૧

जिने जंग बढाया मुद धराया भाव सवाया गतराया
जो कपटी कहाया गाणी पिलायी दीप जलाया हम करिया ।
तो निज जन आता निकट बुलाता आदर पाता बिठलाता,
मैं गुरु गुरु गाता ऊर ऊभराता आगम आता दरशाता ॥१२॥

જે કોઇએ કલ્કી સાથે યુદ્ધ કર્યું તેને પકડી માકસીમાં લઇ ભરી દીધા અને સવાયા કષ્ટમાં ઉતાર્યા, જેને પોતે કપટી પાખંડી સમજ્યાં હતા તેને ઘાણીમા પીલી તેના તેલથી દીપક સળગાવ્યા, જે કોઇ પોતાનો જન આવે છે તેને સારી પેઠે પાસે બોલાવી આદર માનથી બેસાડે છે ...૧૨

तो देश गुजरीया तहं परवरिया सवजल भरिया हे दरिया,
कांकरिया देश तहां करिया कोष सत्तरिया लशकरिया ।
बाना जग धराया सिद्ध जवरमाया नाथ समराया भुलवाता,
मैं गूरु गूरु गाता ऊर ऊभराता आगम आता दरशाता ॥१३॥

realpatidar.com

પછી નકુલંક મિયાં દિલ્લીથી ચાલ્યા તે ગુજરાતમાં આવ્યા. તે ગુજરાત સુંદર

https://archive.org/details/bk753/page/n5/mode/1up

realpatidar.com

જલાશયોથી સુશોભિત અને રસાલ તથા સદા લીલવણીથી રમણીય છે, ત્યાં અમદાવાદના પ્રસિદ્ધ કાંકરિયા તળાવ સમીપે પૌરાણા મુકામે સીતેર હજાર લશ્કર લઈ પડાવ નાખ્યો અને કેટલાક હિંદુ સંસારને પોતાનો વેશ પહેરાવ્યો; જબરી સિદ્ધિ બતાવી લોકોની ભુલો યાદ કરાવી ૧૧ મણ જનોઇઓ ઉતરાવી પીરાના બનાવ્યા, આવી દશા જોઈ મારૂં તો ઉર ઉભરાઈ જાય છે માટે હું તો ગુરુ ગુરૂ ગાઉ છું....૧૩

जन सकल सुधारो कलंक ऊतारो गढ जुनारे पद धारे,
भवनाथ निहारे देश डारे लशकर सारे सुखीयारे ।
तहं गुरू दत्त आता नागल माता जमीयल दाता संगाता,
मैं गुरु गुरु गाता उर उमराता आगम आता दरशाता ॥१४॥

घણા હિંદુઓને સુધારી હિંદુરૂપ કલંક ઉતારી પીરાના બનાવ્યા. પછી ત્યાંથી જુનાગઢ આવ્યા ત્યાં શંકરના મંદિર પાસે પોતનો લશ્કર ઉતાર્યો ત્યાં તે ઘણું સુખી થયા. ત્યાં ગુરૂદત્ત પાસે તથા નાગલ માતા પાસે ગયા જોડે જમિયલ દાતાર પણ હતો...૧૪

नर सिद्ध कहावा कबर समावा खबतर आवा एकसाथा.
वंथलि जावा लग्न धरावा प्रणय बनावा सुरसाथा ।
मेघा पुत्री कहावा नकलंक विहावा सतयुग आता वरताता
मैं गुरू गुरु गाता उर उमराता आगम आता दरशाता ॥१५॥

પછી નકલંક મિયાં પોતાની સીદ્ધિ દેખાડયા કબરયાં સમાઈ ગયા અને એકજ સમયમાં ઘણે ઠેકાણે જઈ દેખાયા પણ ખરા પછી વણુથલી મુકામે જઈ હિંદુ સ્ત્રી સાથે પ્રતય કર્યું તે સ્ત્રી મેઘાભાઈની દીકરી હતી મેઘલી નામ હતુ તેને નકલંકે પરણી બસ એજ સતજુગ આવવાના નિશાની વરતાય છે માટે હું તો ગુરૂ ગુરૂ ગાઉ છું....૧૫

मोबन मन माता खूब खिलाता दांत दिलाता सुखपाता
जूने फिर आता नागलमाता करपोंखाता हरखाता ।
जग हुकम फिराता सत्य धरवाता कली रिखाता सब जाता,
मैं गुरु गुरू गाता उर उमराता आगम आता दरशाता ॥१६॥

તેને નકલંક નામનો પીર પરણીને જુનાગઢ ગયો ત્યાં નાગલ માતાએ હરખાઇને પોંખ્યા. પછી પોતાના સેવકોથી જગમાં હુકમ ચલાવતા સત્યપંથ નામે મજહબ સર્વને પકડાવતાં ફરતા હતા આ રીતે હવે કલીયુગ સર્વ નષ્ટ થતો દેખાય છે ૧૬

जगजीआना मये सयाना गूण निघाना गुणखाना,
आगम यही जाना पूर्ण प्रमाणा सुनत सुजाना सुखमाना ।
जप कलकी देवक भवजल सेसक "तुलसी" सेवक आनंददाता,
मै गुरू गुरु गाता उर उमराता आगम आता दरशाता ॥१७॥

આ પછી જગજીવન નિષ્કલંકજી મોટા શાણા થયા. ગુણનિધાન અને ગુણખાણ બન્યા ભગત તુલસી કહે છે કે મેં પહેલાં જે આગમ આવવાનું સુચવ્યું છે તે એજ પુર્ણ અને સત્ય આગમ છે આ વાતને સુણી સુજણ સુખ માનસે હે કલંકી દેવ આપ ભવજલથી તારણુહાર છો આપનો જય થાવ હે તુલસી સેવકને આનંદ આપનાર આપનો જય થાય જય થાવ....૧૭

પ્રકાશક :- સતપંથ સેવા મંડળ

realpatidar.com